

## સંકલિત જીવાત વ્યવસ્થાપન અંગેનો તાલિમ વર્ગ યોજાયો

કીટકશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ તથા કૃષિ મહાવિદ્યાલય-વ-કૃષિ પોલિટેકનીક, વસો ના સંયુક્ત ઉપક્રમે “સંકલિત જીવાત વ્યવસ્થાપન” અંગેની તાલિમ તારીખ: ૦૧/૦૮/૨૦૧૮ થી ૦૪/૦૮/૨૦૧૮ દરમ્યાન યોજવામાં આવેલ. જેમાં ખેડા જીલ્લાના જુદા-જુદા તાલુકાના કુલ ૬૧ ખેડૂત ભાઈઓએ ભાગ લીધેલ હતો.

તાલિમ વર્ગના ઉદઘાટન કાર્યક્રમમાં શ્રીમતી લીલાબેન પટેલ, સંરપચશ્રી, ગામપંચાયત, વસો; કનુભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્યશ્રી, વસો; મહેશભાઈ પટેલ, પ્રમુખશ્રી, ભારતીય કિસાન સંઘ, વસો તાલુકો; નરેન્દ્રભાઈ પટેલ, માજી સભ્ય; પંકજભાઈ પટેલ, ડીરેક્ટર, વસો સેવા સહકારી મંડળી; ડૉ. વાચ. એમ. શુકલા, આચાર્યશ્રી, કૃષિ મહાવિદ્યાલય-વ-કૃષિ પોલીટેકનીક, આકૃયુ, વસો અને ડૉ. પી. કે. બોરડ, પ્રાધ્યાપક અને વડા, કીટકશાસ્ત્ર, બીએસીએ, આકૃયુ, આણંદ હાજર રહ્યા હતા. વસો ગામના પ્રથમ નાગરીક એવા શ્રીમતી લીલાબહેન પટેલે ખેડૂતોને તાલિમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ જીવાત નિયંત્રણ અંગેના પ્રશ્નોનું નિરાકરણ મેળવવા આહવાન કર્યું હતું.

ઉદઘાટન કાર્યક્રમના અંતમાં ડૉ. એચ. સી. પટેલ, મદદનિશ પ્રાધ્યાપકે આભાર દર્શન વ્યક્ત કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ડી. બી. સીસોદીયા, સહ સંશોધન વૈજ્ઞાનિકએ કર્યું હતું.

આ તાલિમ કાર્યક્રમમાં વિવિધ પાકોમાં નુકસાન કરતી જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન વિષય પર ડૉ. પી. કે. બોરડ, ડૉ. ડી. બી. સીસોદીયા, ડૉ. એચ. સી. પટેલ, ડૉ. પી. એચ. ગોધાણી, ડૉ. આર. કે. હુમર, પ્રો. એમ. ડી. સુથાર, ડૉ. સી. બી. ધોબી, કુ. મિનાક્ષી લુણાગરીયા, ડૉ. એમ. એસ. જાકાસણીયા અને ડૉ. એન. બી. પવાર દ્વારા લંબાણપૂર્વક ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન કરી ઓછામાં ઓછા જંતુનાશકો છાંટીને, પાક સંરક્ષણ ખર્ચ ઘટાડી, રસાયણમુક્ત અને ગુણવત્તાસભર ખેત ઉત્પાદન મેળવવા માટે તાલિમ આપવામાં આવશે. આ તાલિમ કાર્યક્રમમાં ખેડૂત ભાઈઓને પ્રાયોગિક તાલિમ આપવામાં આવેલ.

આ તાલિમ કાર્યક્રમનાં અંતિમ દિવસે આણંદ ખાતે સમાપન કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં ડૉ. કે. પી. પટેલ, આચાર્ય અને વિદ્યાશાખાધ્યક્ષ તથા ડૉ. વાચ. એમ. શુકલા, આચાર્યશ્રી, કૃષિ મહાવિદ્યાલય-વ- કૃષિ પોલિટેકનિલ,વસોએ ઉપસ્થિત રહી તાલિમની જાણકારી બીજા ખેડૂતો સુધી પહોંચે તેવી અભ્યર્થના સાથે આશીર્વાચન આપેલ તથા તેઓશ્રીના હસ્તે પ્રમાણપત્ર અને કીટનું વિતરણ પણ કરવામાં આવેલ.

સમાપન કાર્યક્રમના અંતમાં કુ. મિનાક્ષી લુણાગરીયા, ખેતી અધિકારીએ આભાર દર્શન રજુ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.આર. કે. કુમર, સહ પ્રાધ્યાપકે કર્યું હતું.





